

ભારતીય ચલણની ડુપ્લીકેટ નોટો તથા નોટ બનાવવાની સાધન સામગ્રી સાથે એક ઇસમને પકડી પાડતી, અમરોલી પોલીસ.

ભારતીય અર્થતંત્રને ખોખલુ કરવાના ઇરાદાથી ભારતીય ચલણની બનાવટી નોટો બનાવનાર/વટાવનાર ઇસમોને પકડી પાડવા માટે ઉપરી અધિકારીશ્રીનાઓ તરફથી આપવામાં આવેલ સુચના અને માર્ગદર્શન આધારે સ્ટાફના માણસો આવા ઇસમોની તપાસ કરતા હતા, તે સમય દરમ્યાનમા સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ. શ્રી વી.એ.ડોડીયા નાઓને તેમના અંગત બાતમી આધારે આરોપી-પિયુષકુમાર ઉર્ફે પીલો ડ/0 લાલભાઈ લવભાઈ ક્યાડા (લેઉવા પટેલ) ઉ.વ.૩૨ ધંધો.જમીન દલાલી રહેવાસી, ૧૪૨, એચ.આર.પી બંગ્લોઝ, રોયલ રેસીડેન્સી સામે, જ્ઞાનદીપ સ્કુલ પાસે, કામરેજ કેનાલ રોડ, કામરેજ સુરત ગ્રામ્ય. મુળવતન —ગામ દેડકીવાળા તા. મેંદરડા જી. જુનાગઢનાઓ ભારતીય ચલણની ડુપ્લીકેટ નોટ ૨૦૦૦/- ના દરની નોટ નંગ-૪ કિ.રૂ.૮૦૦૦/- તથા ૨૦૦/-ના દરની નોટ નંગ-૨૪ કિ.રૂ.૪૮૦૦/- તથા કાગળોમા ૨૦૦૦/-ના દરની પ્રિંટ કરેલ નોટ નંગ-૧૦૧ તથા ડુપ્લીકેટ નોટ બનાવવાના સાધનો રકેનર પ્રિન્ટર નંગ-૦૧ તથા પેપર કટર તથા ક્રુટ રકેઇલ નંગ-૦૨ તથા કાગળો તથા ઇકની ખાલી બાટલીઓ નંગ-૦૪ તથા મોબાઇલ નંગ-૦૧ તથા રોકડા રૂપીયા ૫૩,૧૫૦/- મળી કુલે મુદ્દામાલની કિ.રૂ ૮૧,૮૫૦/- ની મતા સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

*શોધાયેલ ગુન્હા-અમરોલી પો.સ્ટે.એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૦૦૪૨૧૧૨૪/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૪૮૯(ક)(ખ)(ગ) (ઘ)(ચ) મુજબ.

**આરોપીનો ગુન્હાહીત ઇતિહાસ- વરાછા પોલીસ સ્ટેશન I- ગુ.ર.નં.૧૩૫/૨૦૧૮ ઇ.પી.કો.કલમ ૩૮૭, ૩૮૫, ૩૪૨, ૫૦૬(૨), ૪૫૨, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ.

***એમ.ઓ. :- ઉપરોક્ત આરોપી પોતે યમુના ચોક ખાતે ભાડાની દુકાન રાખી તેમા પોતાના આર્થિક લાભ મેળવવા સારૂ બ્રધર્સ કંપનીના કલર રકેનર-પ્રિન્ટરમા ૨૦૦૦/- દરની તથા ૨૦૦/- ના દરની નોટ છાપી છુટકમાં બજારમાં પોતે જ ચિજવસ્તુ ખરીદી કરી વટાવી ફરતી કરતા હતા.

જહેરમાં મોબાઇલ ઝુંટવી ભાગવા જતા આરોપીઓને ભાગવા જતા પકડી પાડતી ટ્રાફિક પોલીસ સુરત શહેરમાં ફરજ બજાવતા ASI મેહુલભાઈ દિલસુખભાઈ તથા PC નિલેશભાઈ ઇશ્વરભાઈ તથા LR અનિરૂઘ્ધસિંહ રતનસિંહ તથા ટી.આર.બી. માણસોનાઓ સાંઇદર્શન માર્કેટ ચાર રસ્તા ખાતે ટ્રાફિક નિયમનની ફરજમાં હતા તે દરમ્યાન તેમની પાસે એક વ્યકિત ભાગતા ભાગતા આવેલ અને જણાવેલ કે “એક ઇસમ મારા હાથમાંથી મારો મોબાઇલ ફોન ઝુંટાવીને નાસી ગયેલ છે. જેથી ઉપરોક્ત જણાવેલ કર્મચારીઓએ જેતા ત્રણ ઇસમો દોડતા જતા હતા જેનો પીછો કરતા તેમાંથી એક ઇસમ નામે શેખ આવેશ આમીન શેખ ઉ.વ.૧૯ રહે. ગાંધીનગર ઝુપડપટ્ટી ઉમરવાડા, સુરતનાઓને પકડી પાડી તેના ખીરસા તપાસતા તેના ખીરસામાંથી ઝુંટાવીને નાસી ગયેલ મોબાઇલ ફોન મળી આવતા સદર બનાવ બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૦૦૫૫૨૧૦૭૪૧/૨૦૨૧ તા.૧૨/૦૪/૨૦૨૧ થી દાખલ કરવામાં આવેલ છે.

ઓનલાઇન નાણાકીય છેતરપીંડીના અલગ-અલગ બનાવોમા રૂ. ૨,૬૮,૮૦૭/-રીફંડ કરાવી આપતી કાઇમ બ્રાંચ સુરત શહેર.

સુરત શહેરમાં બનતા ઓનલાઇન નાણાકીય છેતરપીંડીના બનાવોમા ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થવા જણાવેલ જે બાબતે અરજદારશ્રીનાઓએ તાત્કાલીક સમય સુચકતા વાપરી ૧૦૦ નંબર ઉપર ફોન કરી પોતાની વિગતો જણાવેલ અને તુરંતજ કાઇમ બ્રાંચ ખાતે આવી પોતાની રજુઆત જણાવતા ટેકનીકલ ટીમના અ.પો.કો. ચિરાગભાઈ ઢોલરીયા નાઓએ ટેકનીકલ સર્વેલન્સના આધારે એનાલીસીસ તથા જરૂરી કાર્યવાહી કરી ઓનલાઇન નાણાકીય છેતરપીંડીનો ભોગ બનનાર અલગ-અલગ અરજદારશ્રીઓના કુલે રૂ.૨,૮૭,૭૮૫/-ઉપાડી લીધેલ જેમાંથી કુલ રૂ.૨,૬૮,૮૦૭/-અરજદારશ્રીઓના બેંક એકાઉન્ટમા પરત મેળવી આપેલ છે.